

પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર (PAD)

માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ની
કલમ -૪(૧)(ખ) અન્વયે પ્રકરણ - ૧ થી ૧૭

ડાયરેક્ટર
ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ
ગુજરાત રાજ્ય, અમદાવાદ

ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેક્ટી એન્ડ હેલ્થની કચેરી,
ગુજરાત રાજ્ય, અમદાવાદ
માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ, 2005 ની કલમ-4(1)(ખ)
હેઠળની માહિતી.

પ્રકરણ- ૧

પ્રસ્તાવના

લોકશાહીમાં નાગરિકોને માહિતગાર રાખવા અને તેની (લોકશાહીની) કામગીરી તેવી માહિતીની પારદર્શિતા માટે મહત્વની જરૂરી છે અને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખવા અને સરકારો અને તેનાં માધ્યમો પ્રજાને જવાબદાર રહે તે પણ જરૂરી છે.

ખરેખર વ્યવહારમાં માહિતીને જાહેર કરવાથી સરકારના કાર્યક્ષમ સંચાલન, મર્યાદિત નાંણાકીય સાધનોનો મહત્તમ ઉપયોગ અને સંવદેનશીલ માહિતીની ગોપનીયતાની જાળવણી સહિતના બીજા જાહેર હિતો સાથે સંઘર્ષ થાય તેમ છે અને લોકશાહી આદર્શની સર્વોપરિતા જાળવતી વખતે આ સંઘર્ષમય હિતો વચ્ચે સંવાદિતા સાધવી પણ જરૂરી છે.

તેથી જે નાગરિકો માહિતી મેળવવા માંગતા હોય તેમને પારદર્શક અને જવાબદારી પૂર્ણ અમૂક માહિતી પુરી પાડવાના હેતુથી આ પુસ્તીકા બહાર પાડવામાં આવે છે.

ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય તંત્ર દ્વારા નીચે મુજબના કાયદાઓના અમલીકરણ કરાવવામાં આવે છે.

- કારખાનાના અધિનિયમ, ૧૯૪૮ અને તે હેઠળનાં ગુજરાત કારખાના નિયમો, ૧૯૬૩ ના સુધારેલ નિયમો, ૧૯૯૫
- એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ, ૧૯૮૬ અને તે હેઠળના નિયમો
 - મેન્યુફેક્ચર્સ સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હેઝાર્ડસ કેમીકલ રૂલ્સ-૧૯૮૯.
 - કેમીકલ એક્સીડન્ટ (ઇમરજન્સી પ્લાનીંગ એન્ડ પ્રીપેડનેશ એન્ડ રીસ્પોન્સ) રૂલ્સ-૧૯૯૬
- વેતન ચૂકવણી અધિનિયમ, ૧૯૩૬ અને તે હેઠળના નિયમો
- પ્રસુતિ સહાયતા અધિનિયમ, ૧૯૬૧ અને તે હેઠળના નિયમો
- ગુજરાત અપંગ વ્યક્તિઓ (કારખાનાઓમાં રોજગારી) અધિનિયમ, ૧૯૮૨.
- ગુજરાત બેરોજગાર વળતર ભથ્થુ (કારખાનામાં રોજગારી) અધિનિયમ, ૧૯૮૧.
- મકાન અને અન્ય બાંધકામ કામદારો (રોજગારી નિયમન અને નોકરીની શરતો) અધિનિયમ ૧૯૯૬ અને તે હેઠળનાં ગુજરાતનાં નિયમો ૨૦૦૩